અંક-૯
આજીવન લવાજમ
રૂા. ૨૦૦/-

સંસ્કાર દીપ

વર્ષ ૪૧
સપ્ટેમ્બર,
૨૦૧૧

: પ્રેરણા :
પ.પૂ. સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા
પ.પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી
મુદ્રક : સુર્યા ઓફસેટ, આંબલી, અમદાવાદ-૫૮

: તંત્રી :
શ્રી લક્ષ્મણભાઈ આદોજા
સંપાદક : શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામી
કલા સંયોજન : ગોવિંદ જી. બાંટવા

: પ્રકાશક :
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાર્થી સંઘ,
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર, અમદાવાદ.
પીન-૩૮૦ ૦૫૨, સંપર્ક : (૦૭૯) ૨૭૯૧૨૫૯૧

'ભગવાન ભજજો...'

હે જોગી સ્વામી!

અમે મહારાજનાં દર્શન નથી કરી શક્યા પરંતુ તમે મહારાજને બોલતા જોયા છે, ચાલતા જોયા છે એની અમને પૂર્ણ પ્રતીતિ છે, કારણ કે સ્વામી! તમારા વેણે મહારાજે અમારા જેવા હજારોના દુઃખ દૂર કર્યાં છે એ જગ જાહેર છે.

૧૦૭ વર્ષનું સંપૂર્ણ નિરોગી આયુષ્ય ભોગવીને તમે શ્રીજી મહારાજના અક્ષરધામમાં બિરાજી ગયા.

'સ્વામિનારાયણ....'

'સ્વામિનારાયણ....' તમારો શ્વાસ-પ્રશ્વાસ.

'ભગવાન ભજજો, ભગવાન ભજવામાં માલ છે' આ તમારું જીવનસૂત્ર. 'કોઈને દુઃખીયો દેખી ન ખમાય...' તમારા અંતરની સંવેદના.

હે સ્વામી! તમે સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતા સીમિત નથી રહ્યા. તમે કોઈ ભેદભાવ વિના બધા જ જીવોના દુઃખ શ્રીજી મહારાજને નિવેદન કરતા તમારી પ્રાર્થનાના શબ્દો - 'હે મહારાજ! આ જીવને સુખીયા કરો' - હજુ અમારા કાનમાં ગૂંજે છે.

બસ! જે જે આવ્યા શ્રીજીને શરણ,
તેના સર્વે સંકટ કર્યા હરણ.
તમે બન્યા સૌના સુખકરણ.

અમે તમારી ઝૂંપડીએ રાજા કે રંકના ભેદ જોયા નથી. તમારે મન ગરીબ કે તવંગર સહુ સરખા. તમારી કરુણાપૂર્ણ દૃષ્ટિથી સુખી કે દુઃખી સર્વે ન્યાલ થતા અને શ્રીહરિના સ્વરૂપમાં જોડાઈ જતા. 'સુખીયા જગતમાં સંત' એ વચનને જીવનમાં ચરિતાર્થ કરનારા તમે અખંડ આનંદના સમુદ્રમાં ઝીલતા.



મહારાજના સ્વરૂપનો આનંદ, હરિસ્મરણનો પરમાનંદ તમે સતત લૂંટતા. એટલે તો સદ્‌ગુરુ મહંત સ્વામીએ તમારું નામ હરિપ્રકાશ પાડ્યું હશે ને!

પણ હરિપ્રકાશનો અખંડ જોગ મહારાજ સાથે બંધાયો અને ગુરુએ પરમાણ્યા કે; 'આ તો જોગી છે જોગી!'

આ જોગીને જગતનો સ્પર્શ જ નહીં, આ જોગીને સ્ત્રી-ધનની સમજ નહીં, આ જોગીને પ્રવૃત્તિમાર્ગની પીડા નહીં, આ જોગીને વ્યવહારમાર્ગ ફાવે નહીં, આ જોગીને તો બસ મહારાજની મૂર્તિ, આ જોગીને તો બસ અખંડ મહારાજનું ભજન, આ જોગીને તો સતત મહારાજનું જ સામીપ્ય.

તેથી સ્વામી તમે બન્યા,

'અખંડ ભગવદ્‌પરાયણ'.

આ કોઈ યુનિવર્સિટીની ડીગ્રી નથી. આ તો છે અક્ષરધામના મુક્તની ઓળખ. અખંડ મહારાજના સ્વરૂપનો રસ પીઈને અખંડ આનંદ લૂંટનારા તમે અમને ક્યારે અક્ષરધામમાં બોલાવશો?

હવે તમારું દર્શન નહીં થાય? આ વિચારમાત્રથી અમે ભાંગી પડીએ છીએ...પણ તમારું નિર્દોષ, નિષ્કામ, નીરામય જીવન અમને અચળ રાખે છે, સ્થિર રાખે છે અને તમારા

જીવનની, ભજનની સુવાસ અમને તમારા અહીં જ હોવાનો અહેસાસ કરાવે છે.

હે જોગી સ્વામી! અમે તમારા બાળ, તમે અમને ઉછેર્યા, મોટા કર્યા, સંસ્કાર આપ્યા, અમને જગાડ્યા, જગતના માર્ગેથી પાછા વાળ્યા, ભગવાનનો માર્ગ બતાવ્યો, અમને ભગવાનના માર્ગે ચાલતા કર્યા. હે સ્વામી! તમારું તપ અને ત્યાગમય જીવન વિસાર્યું વિસરાય એમ નથી.

હે સ્વામી! આપનો ધન અને સ્ત્રીનો ત્યાગ અજોડ ગણાય. હે સ્વામી! ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત એકાંતિક ભક્તિ તમારા અંતરમાં સદૈવ રમતા રહ્યા.

હે સ્વામી! તમે અમારો સથવારો, અમારે તમારો સંગાથ, અમને તમારું આશ્વાસન, તમારી હૂંફ, તમારો પ્રેમ, તમારો નિત્ય સત્સંગ, તમારું આસન, તમારા સાદગીભર્યા લીંપણની સુવાસ, તમે અમારી સાથે ફૂલ ચૂંટતા, તમે ઠાકોરજીના હાર ગૂંથતા, તમે અમને પણ હરિના હારમાં ગૂંથી લીધા અને અચાનક તમે અક્ષરની વાટે સીધાવ્યા...

આવું કરાય? આવું કરવું હતું તો અમને સાથે ન લેવાય? હે સ્વામી! તમે યોગ સાધતા, તમે ધ્યાન કરતા, તમે માળા કરતા, રાત્રિ-દિવસ તમે ભજન કરતા, તમારી પૂજાનાં દર્શન, તમારી પાસે વચનામૃત સાંભળતા.

અમારા કીર્તન તમે મહારાજને સંભળાવતા અને તમે શ્રીજીની પ્રસાદીની સાકરથી અમારા ખોબા ભરી દેતા! એ સાકરની મીઠાશ અમારા અંતરમાં કાયમ પેસી ગઈ. પણ તમે તો અલૂણા, સદા ઉપવાસી, અખંડ આસન, અખંડ જાપ, અખંડ ધ્યાન અને ક્યારેક દર્શન પણ બંધી. શું તમે મહારાજ સાથે વાતે વળગતા?

તો અમને સંભળાવો એક વાત,
મહારાજને કહો અમારી વાત.

મહારાજને કહેજો કે તમારા જેવા એક મુક્તને આ પૃથ્વી ઉપર અમારી વચ્ચે ફરીથી મોકલે...!!!

પૂજ્ય જોગી સ્વામી

એક વિરલ સંત વિભૂતિની વિદાય

શાંતિ પમાડે તેને સંત કહીએ
એના દાસના દાસ થઈને રહીએ.

આ પંક્તિને ચરિતાર્થ કરતું સંત જીવન એટલે પૂજ્યપાદ જોગી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીનું જીવન.

આધુનિક યુગમાં માન્યામાં ન આવે એવા તેમના ભજનના પ્રતાપની વાતો અને તેમના વ્યકિતત્વના પ્રભાવની વાતો તેમના સંપર્કમાં આવનારા સૌને અનુભવવા મળી છે.

સમાજ જીવનથી સદાય અલિપ્ત, લૌકિક જીવનથી હંમેશાં વેગળા અને સ્વમસ્તીમાં મસ્ત રહેનારા આ સંતવર્ય વર્તમાન સમયના એક વિરલ સંત વિભૂતિ હતા.

૧૦૭ વર્ષનું દીર્ઘાયુષ અને નખમાં પણ રોગ નહીં.પૂજ્ય સ્વામીજીની સેવા કરનાર ડોકટરો હંમેશા સ્વામીને તપાસીને કહેતા કે 'સ્વામીજીનું હૃદય તો નાના બાળકની જેમ ધબકે છે.'

મનુષ્ય શરીરમાં સંતપણું એટલે નિર્મળ અને નિર્દોષ જીવન.બ્રાહ્મણ,સાધુ,ફકીરને પવિત્રપણે જોનારી અને માનનારી ભારતીય સંસ્કૃતિમાં જ આવા સંતના દર્શન થાય છે,તેમાં પણ સ્વામિનારાયણ ભગવાનના સંત એટલે નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ, નિઃસ્નેહ અને નિર્માનીપણાની સાક્ષાત્ મૂર્તિ. આવા પંચ વ્રતે પૂરા શૂરા પૂજ્યપાદ જોગી સ્વામીને સૌ કોઈ અખંડ ભગવત પરાયણ કહેતા અને પૂ.સ્વામીને અખંડ ભગવાનમાં જોડાયેલ નિહાળતા.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પોતાનું મોટા ભાગનું જીવન વ્યતિત કરનારા પૂ.જોગી સ્વામી એટલે દીન દુઃખીયાના બેલી,ભગવાનના માર્ગના ભોમિયા,મુમુક્ષુ ,સાધકોના મશાલચી અને પરમહંસ અવસ્થાના અનુભવી એક મહાપુરુષ.

શ્રી જોગી સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ ભાદરા, જે મુક્તોના પ્રાગટ્યની ભૂમિ ગણાય છે, એ અક્ષરના આગમનની ભોમકા ગણાય છે એવા ભાદરા ગામમાં આ મુક્તાત્માનો જન્મ થયેલો.

માતા ગંગાબેન અને પિતા કલાભાઈ ભંડેરી પરિવારમાં પ્રગટેલા આ મહાપુરુષનું બાળપણનું નામ દેવજી હતું.દેવના દીધેલા અને દેવ જેવા આ દેવજીને બાળપણથી જ ભાદરા ગામના સ્વામિનારાયણ મંદિરમાં સાંજ સવાર આરતી ટાણે દિવ્ય રુપે દેવતાના દર્શન થતા. દેવજીભાઈ નાના હતા અને દરરોજ ભગવાનના મંદિર જતા ત્યારે તેમના હાથમાં સાકર અને શ્રીફળની પ્રસાદી કોણ આપી જતું તે ખબર પડતી નહીં.

ભોળાના ભગવાન એ ન્યાયે દેવજીભાઈ સ્વભાવથી જ બાળા ભોળા હતા.અને ભાદરા ગામની નજીક વહેતી ઊંડ નદીને કિનારે બેસી માટીના શિવલીંગ બનાવીને ભોળાનાથને

ભજ્યા કરે.નિત્ય મંદિર જવું, દર્શન કરવા,માતા પિતાની આજ્ઞામાં રહી ઘરનું અને ખેતરનું કામકાજ કર્યા કરે.

ગામમાં સાધુ-સંતો આવે ત્યારે એના દર્શન કરીને ધન્યતા અનુભવે, દેવજીને સાધુ ખૂબજ ગમતા અને સંતોના સમાગમથી જ દેવજીને સાધુ થઇ જવાનો સંકલ્પ થયો. પરંતુ માતા પિતાએ યુવાન દેવજીના પરાણે લગ્ન કરી દીધા હતા. તેમને એક પુત્રીનો જન્મ પણ થયો હતો, આ પુત્રીનું નામ ઉજી હતું.

૩૦ વર્ષની ઉંમરે તીવ્ર વૈરાગ્યના વેગથી દેવજીભાઇ ગૃહત્યાગ કરીને ચાલી નીકળ્યા. ગોંડલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં જઇને સમર્થ સંત મહંત શ્રીકૃષ્ણજીવનદાસજી સ્વામીના શિષ્ય બનીને રહ્યા. મહંત સ્વામીએ દેવજીભાઇને ગૃહસ્થનો પરિવેશ ઉતરાવીને પાર્ષદની દિક્ષા આપી અને દેવજીભાઇ બન્યા પાર્ષદ દેવજી ભગત.

વિનમ્ર સ્વભાવના દેવજી ભગત પૂ. ગુરુદેવ મહંત સ્વામીની આજ્ઞા પ્રમાણે મંદિરની સેવામાં હરખથી જોડાયા અને ગાયોની સેવા- છાણા થાપવા,વાસીદા કરવા વગેરે કરવા લાગ્યા અને સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. સેવા અને સ્મરણ સાથે દેવજી ભગત કીર્તનો ગાય અને સંતોની સત્સંગ સભર શાળામાં અક્ષર જ્ઞાન પણ મેળવે.

અતિ સાદગી ભર્યો વેશ,સાદુ ભોજન,ભોંયપથારી ,અને સંતોની સેવા સાથે હરિચરણમાં અનુરાગ ધરાવતા દેવજીભાઇને પૂ.મહંત સ્વામીએ જૂનાગઢ મુકામે સંવત્ ૨૦૦૧ ફાગણ વદ-૮,બુધવાર તા. ૭/૩/૧૯૪૫ના રોજ વડતાલના ધ.ધુ.પૂજ્યપાદ ૧૦૦૮ આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજના હસ્તે ભાગવતી દીક્ષા આપી 'હરિપ્રકાશદાસજી સ્વામી' નામ પાડ્યું.

સદ્ગુરુના સાન્નિધ્યમાં સાધકના અંતરના મેલ ધોવાઇ જાય છે. પૂ. મહંત સ્વામીના વચનથી સાધુ હરિપ્રકાશદાસજીના અંતરમાં ઉજાસ થયો અને ચૈતન્ય તેજનો ઉઘાડ થયો. દેહની કોઇ ચિંતા નહીં. વિતરાગી અને તપસ્વી તેમજ ભજન પરાયણ રહેતા આ સાધુને પૂ. મહંત સ્વામી 'જોગી'ના હુલામણા નામે બોલાવવા લાગ્યા અને ત્યારથી સ્વામીને સૌ કોઇ 'જોગી સ્વામી' તરીકે ઓળખાવા લાગ્યા.

સત્સંગની પરમહંસ અવસ્થામાં મનને મેળવ્યું. શરીરને કેળવ્યું અને આત્માને અખંડ હરિસ્મરણમાં જોડી દીધો. ગામડામાં વિચરણ કરે, ગુરુની આજ્ઞા પ્રમાણે સૌની સેવા કરે, મહિમાથી ગુરુની સેવા કરે.એકાંત સ્થળમાં બેસીને ભજન કર્યા કરે.

પૂજ્ય ગુરુવર્ય મહંત સ્વામીએ અક્ષરધામમાં જતા પહેલા પૂ.જોગી સ્વામીને આજ્ઞા કરેલી કે 'હવે તું ગુરુકુલમાં રહેજે.'અને જોગી સ્વામી ગુરુદેવની આજ્ઞા પ્રમાણે સંસ્કાર ભૂમિ રાજકોટ ગુરુકુલમાં કાયમ માટે પધાર્યા.

ગુરુકુલમાં જોગી સ્વામીનું જીવન એટલે ભગવાનની સેવા, ભજન, તપ, વ્રત, નિયમ અને આશીર્વાદની અમીધારા.

ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરુકુલના માધ્યમથી જે સંસ્કાર યજ્ઞનો આરંભ કર્યો હતો તેમાં પૂ.જોગી સ્વામી જેવા સંતની ઉપસ્થિતિ માત્ર સૌને સત્સંગની પ્રેરણા આપતી હતી. કોઇ પણ વ્યાવહારિક પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ રીતે જોડાયા વિના જ પૂ. જોગી સ્વામી સૌ વિદ્યાર્થીઓ, સંતો, હરિભક્તોને સેવામાં જોડતા, ભજન કરાવતા, કીર્તનો ગવરાવતા, વચનામૃત વંચાવતા અને કંઠસ્થ કીર્તનો ગાનારા ઉપર રાજીપો વરસાવતા.

ગુરુકુલમાં જોગી સ્વામીનું આસન એટલે સત્સંગના સંસ્કારોની જીવંત પાઠશાળા. સ્વામી તો અખંડ ભજન કરે અને સ્વામીનો રાજીપો મેળવવા સંતો ઠાકોરજીના હાર ગૂંથે. વિદ્યાર્થીઓ ચંદન ઘસીને ઠાકોરજી માટે તૈયાર કરે. યુવાનો સ્વાધ્યાયમાં બેસી જાય. વડીલ હરિભક્તો કથા સાંભળે અને જોગી સ્વામી સૌના ઉપર અમી દૃષ્ટિ કરે એટલે સૌના અંતરમાં સુખ-શાંતિ અને સમર્પણની સરિતા પ્રગટ થાય.

પૂ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અક્ષરધામમાં સીધાવ્યા ત્યારબાદ પૂ. જોગી સ્વામી સમગ્ર ગુરુકુલ પરિવારના આશ્વાસન અને માથુ ટેકવવાનું આશ્રય સ્થાન હતા. કોઇપણ દીન-દુ:ખિયાના દુ:ખ દૂર કરવા માટે જોગી સ્વામી સંકલ્પ કરતા અને શ્રીજી મહારાજના પ્રતાપથી એના દુ:ખ દૂર થતા. હરિભક્તોને સત્સંગનું સુખ આપવા માટે પૂ. જોગી સ્વામી ગામડાંઓમાં વિચરણ કરતા. નાના હરિભક્તની વિનંતી પૂ. સ્વામી સ્વીકારતા અને તેના ખેતર, વાડી, ઘરને પાવન કરતા. પૂ.સ્વામીના આશીર્વાદથી સૂકા ભઠ્ઠ કૂવામાં પાણીની નૂતન સરવાણી ફૂટતી. મેઘરાજા પૂ.સ્વામીના સંકલ્પથી વરસતા.

અનેક વાંઝિયાઓને ઘેર પારણિયા બંધાતા. અસાધ્ય રોગીથી પીડાતા નિરોગી બનતા અને મૃત્યુના મુખમાં ધકેલાઇ ગયેલા અનેક ભાવિકો પુનઃ જીવન મેળવતા. મુમુક્ષુ સાધકોના સંકલ્પ શમી જતા અને અધ્યાત્મના આરાધકો માટે તો પૂ.સ્વામી એક આદર્શ અનુકરણીય મૂર્તિ બની ગયેલા.

કોઇ ચમત્કાર કે કોઇ આશ્ચર્યકારક ઘટના પૂ. સ્વામીને મન શ્રીજી મહારાજનો પ્રતાપ અને પ્રભાવ હતો. પોતે તો સદાય અલિપ્ત રીતે સીધું-સાદું-સરળ-સાધનામય જીવન અપનાવીને હરિભજનમાં મસ્ત રહેતા.

પૂ.જોગી સ્વામીના શરીરની ઉંમર ૯૫ વર્ષ જેટલી થયા બાદ સ્વામી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદ ખાતે નિવાસ કરતા. પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીના સેવાભાવી સ્વભાવને કારણે પૂ.જોગી સ્વામી મેમનગર ખાતે સૌને દર્શન આપી સત્સંગની પ્રેરણા આપતા.

પૂ.જોગી સ્વામીની અખંડ સેવામાં યુવાન સંતો તત્પર રહેતા. પૂ.વિશ્વવિહારી સ્વામી અને શ્રી વલ્લભદાસજી સ્વામી અત્યંત શ્રદ્ધાભાવ સાથે પૂ.જોગી સ્વામીની સેવા કરતા. આ સંતોની સેવાને શબ્દોમાં મૂલવી ન શકાય.

૧૦૭ વર્ષની જૈફ ઉંમરે પૂ. જોગી સ્વામીએ છેલ્લા

"SANSKARDIP" R.N.I. 15104/68 Permitted to post at Ahd. PSO on 9th of every month. Registered under Postal Reg. No. GAMC-1729/2010-2012 valid up to 31-12-2012 issued by SSP Ahmedabad-9. Licenced to post without Prepayments No. CPMG/GJ/85/10-12/valid upto 31-12-2012.

શ્વાસ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ ખાતે તા.૨૮/૮/૨૦૧૧ (રવિવાર)ના રોજ સાયંકાળે ૦૭:૦૭ કલાકે લીધા ત્યારે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયે એક આંચકાનો અનુભવ કર્યો અને સર્વે સંતો-હરિભકતો ઘેરા શોકની લાગણીમાં સરી પડ્યા. તા.૩૧/૦૮/૨૦૧૧ને બુધવારે બપોરે શ્રી જોગી સ્વામીના અંતિમદર્શન માટે દેશ-દેશાવરના લાખો ભકતજનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ ફિરકાઓના સંતો-પાર્ષદો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્, છારોડી ખાતે ઉમટી પડ્યા અને ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ અને વૈદિક વિધિ સાથે છારોડી ખાતે જ પૂ.જોગી સ્વામીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે લાખો લોકોની આંખોમાંથી અશ્રુધારાઓ વહી રહી.

સંસ્થાના વડા સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે પૂ.જોગી સ્વામીના પાર્થિવ દેહને અગ્નિદાહ અપાયો. હરિના નામનો જ માત્ર જાપ કરીને સમગ્ર સત્સંગમાં હરિનો પ્રકાશ પાડી રહેલા જોગી સ્વામીના જીવનનો માત્ર એક જ સંદેશ - 'ભગવાનને ભજતા રહેજો.'

આ સંદેશને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ એ જ પૂજ્ય જોગી સ્વામીને માટે સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.

પૂ.જોગી સ્વામીના જીવનને યથાર્થ રીત રજૂ કરતું અને પૂ.સ્વામીની હાજરીમાં જ પૂ.શા.માધવપ્રિયદાસજી સ્વામીએ સ્વહસ્તે લખેલું પુસ્તક **'જોગી સ્વામીની જીવન ગાથા'** અનેક ભાવિક, મુમુક્ષુઓ અને અધ્યાત્મના પથિકોને પ્રેરણા અપાતું રહેશે.

પૂ.જોગી સ્વામીની શ્રદ્ધાંજલિ સભા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્, છારોડી ખાતે તા.૧૧/૯/૨૦૧૧ (રવિવાર)ના રોજ સાંજે ૪ કલાકે રાખવામાં આવી હતી.

પૂ. જોગી સ્વામીના અંતિમ દર્શન

અભિષેક દર્શન

પાલખી યાત્રા

શ્રદ્ધા-સુમન અર્પણ

અંતિમ યાત્રા

પૂ. જોગી સ્વામીના અંતિમ દર્શને ભક્ત સમુદાય

If undelivered Please Return to: Shree Swaminarayan Gurukul Gurukul Road, Memnagar, Ahmedabad - 380052	To,